

શિક્ષણ અને સમાજ
કલ્યાણ કેન્દ્રનું
માસિક મુખ પત્ર



વર્ષ : ૧૫

અંક : ૧

સામાજિક કાર્ય

સામાન્ય રીતે પાયાના પ્રશ્નોને ઓળખી તેને ઉકેલની દિશામાં લઈ જવાની બાબતને સામાજિક કાર્ય કહે છે.

આજકાલ રાજકીય, સેવાકીય, વ્યવસાયીક કે અન્ય સંગઠનો કે વ્યક્તિગત રીતે સમાજસેવાની બાબતો સાથે સંકળાયેલા લોકો પોતાની રીતે કાર્ય કરી રહ્યા છે.

સમાજ કાર્ય માટે ઘણાં અભ્યાસક્રમો શરૂ થયેલ છે. જેથી આ કાર્ય યોગ્ય પદ્ધતિ મુજબ હાથ ધરી શકાય છે.

સામાજિક કાર્યકર્તાઓ માટે તેઓની ભૂમિકા અને જવાબદારીઓ અંગે શિક્ષણ આપવામાં આવે છે. જેની ટુંકી વિગતો નીચે મુજબ છે જે આ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે ઉપયોગી બની શકે છે.

લાક્ષણિકતાઓ :

જીજ્ઞાસા, કલ્પના, સામાન્ય સમજ, સંગઠનાત્મક વ્યક્તિત્વ, મુક્ત અને ખુલ્લુ મન, બારીક જટીલ નજર અને ગ્રહણશીલ કાન.

કૌશલ્યો :

સમસ્યા વિશ્લેષણ, સંશોધન ગતિશીલતા,

સંઘર્ષ નિવારણ, મીટીંગનું આયોજન – વ્યવસ્થાપન, અહેવાલ લેખન, જોડાણ, તાલીમ

ભૂમિકાઓ :

સંપર્કકર્તા - Communicator, શક્ય બનાવનાર - Enabler, જીવંત બનાવનાર - Animator, માર્ગદર્શક/ભોમિયો - Guide, પરામર્શક - Counselor, સાથે મળીને કામ કરનાર - Collaborator, સલાહ આપનાર - Consultant, નવા ફેરફાર કરનાર - Inovator, આદર્શ/અનુકરણીય - Model, પ્રેરક - Motivator, ઉત્તેજક/અસર ઉપજાવનાર - Catalyst, હિમાયતી/પક્ષકાર - Advocate, જોડાણ - Fecilitator, મધ્યસ્થી/સમજૂતી કરાવનાર - Mediator અને કેળવનાર - Educator.

પ્રિય વાચક મિત્રો,

ટપક માટે આપ, સહયોગ રાશિ મોકલી શકો છો. ટપકને મોકલવામાં આવનાર આ રકમ ચેક અથવા ડ્રાફ્ટ થી શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનાં નામે મોકલવા વિનંતી છે. આપની આસપાસ બનતા બનાવો કે જે બીજા લોકો માટે અનુકરણીય હોય તેની વિગતો ટપકને મોકલી શકો છો તેથી અન્ય લોકો તે વિશે માહિતગાર બનશે.

– ટપક ટીમ

તમે તમારા કાર્યમાં ઓત પ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે.

Believe in Yourself

There may be days when you get up in the morning and things aren't the way you had hoped they would be.

That's when you have to tell yourself that things will get better. There are times when people disappoint you and let you down.

But those are the times when you must remind yourself to trust your own judgments and opinions, to keep your life focused on believing in yourself.

There will be challenges to face and changes to make in your life, and it is up to you to accept them.

Constantly keep yourself headed in the right direction for you. It may not be easy at times, but in those times of struggle you will find a stronger sense of who you are.

So when the days come that are filled with frustration and unexpected responsibilities, remember to believe in yourself, all you want your life to be.

Because the challenges and changes will only help you to find the goals that you know are meant to come true for you.

Golden Rules:

If you open it, close it.

If you turn it on, turn it off.

If you unlock it, lock it up.

If you break it, admit it.

If you can't fix it, call in someone who can. If you borrow it, return it.

If you value it, take care of it.

If you make a mess, clean it up.

If you move it, put it back.

If it belongs to someone else and you want to use, get permission.

If you don't know how to operate it, leave it alone.

If it's none of your business, don't ask questions.

If it ain't broke, don't fix it.

If it will brighten someone's day, say it. If it will tarnish someone's reputation, keep it to yourself.

Golden Words

Often when we lose all the hope and think this is the end.

God smiles from above and says

"Relax guys, it is just a bend, not the end".

We will have a helping hand in one way or other

it we who have to explore that adventure.

મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનાં ચારિત્ર્ય, ટેવ અને જીવનને બદલી નાખે છે.

આજની વાત

સફળ થવું હોય તો નિશાન ઉંચું હોવું જોઈએ.
મોટા સપના જોવાની હિંમત હોવી જોઈએ
હા પણ તે ઉપરાંત જરૂરી છે તે સપનાને યોગ્ય
થવાની લાયકાતની

ત્યાં પહોંચવાનો થનગનાટ..પ્રયત્ન
અને ક્વચિત નિષ્ફળ થવાય તો તે નિષ્ફળતાને
પચાવી ફરી સફળ થવાનો સુપ્રયત્ન
અને જો સફળ થયાને તો મિત્રોમાં અહોભાવ
અને પ્રતિસ્પર્ધામાં ઈર્ષા દેખાશે.

સાચો રસ્તો તો એ છે કે વડ જેવા બનો
મિત્ર કે પ્રતિસ્પર્ધીને સાથે રાખી સહિયારા
પ્રયત્ન કરો
વડવાઈઓમાં પણ ઘગશ હોય છે નવું
કરવાની.....

અને નવા વડ બનવાની
ઈર્ષા નહીં સહિયારા સપને આગળ વધીએ
એક મેકનાં ટેકે વિકસીએ ને ઝંઝાવાતો ને પણ
ખાળીએ.

— વિજય શાહ

તમે સમયને ડાઉનલોડ કરી શકો નહિ.
તમે પ્રેમને અપલોડ કરી શકો નહિ.
જીવનમાં ગુગલ બધા જવાબો આપી શકે નહિ
તેથી
સીધે સીધા વાસ્તવિકતાનું લોગીન કરો
તમને તમારા જીવનનું સ્ટેટસ ગમવાં લાગશે.

— વિપુલ દેસાઈ

સમયનું મહત્વ ઓછું આંકશો નહિ

પૈસા—દોલત એ કિંમતી ધન નથી પણ સમય
સૌથી કિંમતી ધન છે. એ વસ્તુ તમે હંમેશા યાદ
રાખો.સમયસર કરેલા કામ જ ઉગી નીકળે છે.
સમય વીતી ગયા પછી કામનું ફળ મળતું નથી.
કેટલાંક કાર્યો એવા હોય છે કે જે નિશ્ચિત સમયે
ન કરવામાં આવે તો તેનું પરિણામ સાડું આવતું
નથી. કેટલીક વખત તક સામે આવીને ઉભી
હોય છે પરંતુ એ વખતે લાંબો વિચાર કરવા
રહો, અન્યની સલાહ લેવા જવાનું તમે
વિચારો,કોઈ હા પાડે અને કોઈ ના પાડે ત્યારે
દ્વિધા અનુભવો અને કોઈ એક ચોક્કસ નિર્ણય
પર ન આવી શકો તો હાથમાં આવેલી એ તક
સરી પડે છે અને કેટલીક વાર તો જીવનમાં
એવી તક ફરી સાંપડતી નથી. લક્ષ્મી ચાંદલો
કરવા આવે ત્યારે મોં ઘોવા જશો નહિ.
વિશ્વના મહાન પુરુષો સમયની કિંમત સારી
પેઠે જાણતા હતા અને તેમને મળતી પ્રત્યેક
ક્ષણોનો તેમણે સદુપયોગ કર્યો છે. પૂજ્ય
ગાંધીજીનું જ દ્રષ્ટાંત લઈએ તો તેઓ સમયનું
મહત્વ સારી પેઠે સમજતા હતા. થોડાં જ
વર્ષોમાં તેમણે ભારતની જે કાયાપલટ કરી તેનું
એક કારણ એ પણ હતું કે તેઓ એક પણ ક્ષણ
નકામી જવા દેતા નહોતા.


મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.

એમઆઈએસ કાર્યશાળા

તા.૨૦ જાન્યુ.૨૦૧૩ના ૧ દીવસીય કાર્યશાળા સરકેશ્વર મુકામે યોજાઈ ગઈ જેમા ૭૫ ખેડૂતો હાજર રહ્યા હતા.

શ્રી ભરત વાળાએ સ્વાગત પરીચય બાદ હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવામાં ઉદાસીનતા અને તેના કારણો

તેની જગ્યાએ ખારા પાણીની હાજરી અને દર વર્ષે પાણી અને જમીનમાં ખારાશના પ્રમાણમાં થઈ રહેલો વધારો જેથી આ વિસ્તારમા ખેતી આધારિત જીવન નિર્વાહ ચલાવતા પરિવારોને અસર થતી હતી. ખારાશ વધતી અટકાવવા વિવિધ સ્તરે ચાલતા પ્રયાસોમાં કોસ્ટલ સેલીનીટી સેલ અને સ્થાનિક સંગઠનો સાથે આ



જાણવા તથા ભૂગર્ભજળનું સંતુલન, મીઠા પાણીનું સ્તર, ખારાશની માત્રા વિગેરેની ચર્ચા માટે આ કાર્યશાળા યોજવામાં આવી છે.

દરિયાના કાંઠાળ વિસ્તારોમા હયાત સિંચાઈ વ્યવસ્થાથી ભૂગર્ભજળ રીચાર્જ અને સ્ત્રાવ વચ્ચે અસંતુલન, મીઠાપાણીના વધુ વપરાશથી

વિસ્તારના ખેડૂતો કાર્યરત છે તે પૈકી ભૂગર્ભજળ ના ઉપયોગ માટે કાર્યક્ષમ સાધનો તેમજ માઈક્રો ઈરીગેશન સીસ્ટમનો ઉપયોગ ખૂબજ ઓછા લોકો કરી રહ્યા છે. સંસ્થાઓની મદદથી એન્ટરપ્રીનીયોર તૈયાર કરી કાયમી ધોરણે તેઓ સ્થાનિક સ્તરે કાર્યરત રહી માઈક્રો ઈરીગેશન

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ વધારે હોય છે.

સીસ્ટમનું મહત્વ સમજાવી તેનું વેચાણ કરતા રહે અને તેનું મેઈન્ટેનન્સ માટેની સેવાઓ આપે તો એમઆઈએસના ઉપયોગને ઉત્તેજન મળે. એમઆઈએસના ઉપયોગ માટે તૈયાર થઈ શકે તેવા ખેડૂતોને તારવવા માહિતીનું એકત્રીકરણ. અભિયાન — પ્રચાર સાહિત્યનું વિતરણ, જરૂર મુજબના દવા અને ખાતરના ઉપયોગ સાથે પાણીનો બચાવ અને વધુ ઉત્પાદન અંગે આદાન પ્રદાન. એમઆઈએસનું વેચાણ પ્રથમ છ માસમાં શરૂ કરી તેને જે તે ખેડૂતને ત્યાં સ્થાપિત કરવી. દર માસે તેની મુલાકાત લઈ માર્ગદર્શન આપવું તેમની ફરિયાદ હોય તો નિરાકરણ કરવું. ખેડૂતો માઈક્રો ઈરીગેશન સીસ્ટમ અપનાવવા તૈયાર થશે તો પાણીનો કરકસર પુર્વક ઉપયોગ થશે, જંતુનાશકો ખાતર વિ.નો વપરાશ જરૂર પુરતો થાય જેથી ખેડૂતોનો ખર્ચ અને તેમના ખેતરોમાં મીઠા પાણીની જગ્યાએ ખારા પાણીનું દબાણ ઘટતા તેટલી જમીન અને પાણી ખારાશથી બચશે તેમ સંસ્થાના ડાયરેક્ટરશ્રી ધીરુભાઈ વાગડીયાએ જણાવ્યું હતું.

શ્રી અશોક શેલારે આ વિસ્તારમાં થયેલ કામગીરીની વીગતો આપી હતી જેમાં ખેતી પાક વૃદ્ધિ તથા ખારાશ ઘટાડવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા કૃષિ યુનિવર્સિટી સાથે સંકલનથી ટકાઉ અને સમાન રીતે લાભપ્રદ એવી સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, મીઠા પાણીના સ્ત્રોતની જાળવણી

માટે શ્રેષ્ઠ ટેકનોલોજીના ઉપયોગ માટે જાણકારી તથા હાલની પરંપરાગત સિંચાઈ પદ્ધતિથી માટીની ફળદ્રુપતા પર થતી અસર પાણી, ઊર્જા જેવા દુર્લભ સ્ત્રોતનું સંરક્ષણ સાથે ફળદ્રુપ દ્રવ્યો અને માનવબળના ઉપયોગ અને કાર્યક્ષમતા સુધારવા ખેડૂતો સાથે સતત વાર્તાલાપ, તાલીમો પ્રેરણા પ્રવાસ તથા નિદર્શનો યોજવામાં આવેલ છે.

સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા જીજીઆરસી તરફથી મળતી સહાય ઉપરાંત આરકેવીવાય, માર્કેટયાર્ડ તથા સ્થાનિક કંપનીઓની વધુમાં વધુ સહાય મેળવી આ કાર્યમાં ખેડૂતોને સામેલ કરી શકાશે તેમ શ્રી સુરેશભાઈ ગોહીલએ જણાવ્યું હતું.

સુક્ષ્મ પિયત પદ્ધતિ માટેના જલગાવ (જૈન ઈરીગેશન) તથા કૃષિ યુનિવર્સિટી— નવસારીની જાફરાબાદ વિસ્તાના ખેડૂતો માટેના પ્રેરણા પ્રવાસની વિગતો નાબાર્ડના એજીએમશ્રી નીલેષ શાહએ આપી હતી આ ઉપરાંત તેઓએ નાબાર્ડની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

એન્ટરપ્રિનીયોર શ્રી ભુરાભાઈ વાઢેરએ રાજુલા તથા જાફરાબાદ વિસ્તાર (ઉના અને ખાંભાનો અમુક વિસ્તાર)માં અંદાજે ૨૦ ગામોમાં વીલેજ મીટીંગ કરી અંદાજે ૬૦૦ થી વધુ ખેડૂતોનો સંપર્ક સાધી કામગીરી શરૂ કર્યાનું જણાવી સૌનો આભાર માની કાર્યશાળા પુર્ણ કરવામાં આવી.

હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.

તાલીમ

રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા (સ્પીપા) અમદાવાદ અને એનઆઈઆરડી હૈદરાબાદના સંયુક્ત ઉપક્રમે ગ્રામિણ ગરીબી પર રીજયોનલ પ્રોગ્રામ ઓન પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ સોશ્યલ સીક્યોરીટી પ્રોગ્રામ પર તાલીમ ૭ થી ૧૦ જાન્યુઆરી-૨૦૧૩ દરમિયાન યોજાઈ હતી. જેમાં સંસ્થાના પ્રતિનિધિ શ્રી સાજીત રાઠોડ જોડાયા હતા.

આ તાલીમમાં સામાજિક સુરક્ષિતતા અંગે પરિચય અને વિસ્તૃત સમજ, સામાજિક સુરક્ષિતતાના સિધ્ધાંત અને આપવામાં આવતી સામાજિક સુરક્ષાઓની રણનીતી પર ચર્ચા કરવામાં આવી હતી.

ભારતના બંધારણમાં અસંગઠીતો માટે સામાજિક સુરક્ષિતતાની જોગવાઈઓ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, વિકલાંગોના કલ્યાણ, અન્ન સુરક્ષા, મહિલા અને બાળ કલ્યાણ, મહિલા સશક્તિકરણ વગેરે સામાજિક સુરક્ષિતતાને લગતી બાબતો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ડો. પી. સી. સીકલીગર (એનઆઈઆરડી હૈદરાબાદ), પ્રો. હેમંત કુમાર શાહ (એચ. કે. કોલેજ), શ્રી એમ. એસ. શાહ (ડીવીઝનલ મેનેજર એલઆઈસી) પ્રોફેસર તેમજ ડો. આર. એસ. પટેલ વિગેરે નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં

જીવનવીમો, મધ્યાહન ભોજન, એમ. એન. આર. જી. એ. પર વાત કરવામાં આવી હતી. ચાર દિવસની આ તાલીમમાં એક દિવસની એક્સપોઝર વિઝીટ પણ કરવામાં આવી હતી. જે સાયલા મુકામે શ્રી રાજસોભાગ આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આશ્રમ અને વિકલાંગો માટે ચાલતી શાળાની મુલાકાત કરવામાં આવી હતી. વિકલાંગ સુરક્ષા પણ આ તાલીમનો એક મુદ્દો હોવાથી વિકલાંગોની મુલાકાત લેવામાં આવી હતી. શાળા આર્શીવાદ ટ્રસ્ટ ફોર ડિસેબલ્ડ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં વિકલાંગો જેવાકે પ્રજ્ઞાચક્ષુ, બહેરા-મુંગા વગેરે બાળકો માટેની કાળજી તેમજ તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટેની વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે.

આઈપીએમ

સંકલિત જીવાત નિયંત્રણ એટલે કે પાકનાં વિવિધ શત્રુઓ જેવાકે જીવાત, રોગ વગેરેનાં નિયંત્રણ માટે યાંત્રિક, જૈવિક અને રાસાયણિક પદ્ધતિઓનું સંકલન કરી, પર્યાવરણને નુકશાન કર્યા સિવાય જીવાતોને તેની ક્ષમ્ય માત્રા નીચે રાખવાના ઉપાયો યોજવા માટેની સંસ્થાના ખેતીવાડી અધિકારીઓની તાલીમ તા. ૧૬ જાન્યુ. ૨૦૧૩ ના રોજ સીએસપીસી ખાતે યોજાઈ હતી જેમાં શ્રી અશોક શેલાર જોડાયા હતા.

જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.

સ્ત્રી હિંસા વિરોધી ઝુંબેશ

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલા દ્વારા તા. ૭/૧/૧૩ થી ૧૩/૧/૧૩ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું આયોજન ગાયત્રી સંસ્કાર વિદ્યાલય મીઠાપુર (ડુંગરી) ચલાલા મુકામે કરવામાં આવ્યું હતું. આ સાત દિવસીય શિબિરમાં વ્યક્તિત્વવિકાસ, મૂલ્યશિક્ષણ, સ્વચ્છતા, વૈદિક સંસ્કૃત જેવા વિષય અંગે સાત દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરની પ્રવૃત્તિઓમાં જોઈએ તો આરોગ્ય મૂલક પ્રવૃત્તિઓમાં ગ્રામ સફાઈ, વ્યસન મુક્તિ માટે સદ્ પ્રવૃત્તિ, રેલી બાળતંદુરસ્તી, સ્વચ્છતા આરોગ્ય ઝુંબેશ સર્વરોગ નિદાન કેમ્પ, નેત્રરોગ નિદાન કેમ્પ, પશુરોગ નિદાન કેમ્પ, ડેંગ્યુ, એઈડ્સ, ટીબી જેવા રોગ અંગે જાગૃતિ, ભ્રુણહત્યા નિવારણ, વૈદિક સંસ્કૃતિનો પરિચય, દિપયજ્ઞ, મૂલ્યશિક્ષણ તેમજ જ્ઞાન અને સંસ્કાર મૂલક પ્રવૃત્તિઓમાં પ્રભાતફેરી, ભીતસૂત્ર લેખન, વ્યાખ્યાનમાળા, આરોગ્યલક્ષી મોજણી, ઘરેલું હિંસા અટકાવવી, યોગ શિબિર, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન, અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે જેવી કામગીરી કરવામાં આવી હતી.

આ સાત દિવસના કેમ્પમાં તા. ૧૧.૧.૧૩ ના રોજ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી

દ્વારા ઘરેલું હિંસા અને જેન્ડર વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય મીઠાપુર (ડુંગરી) ચલાલાનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રતિદાદા, સંચાલકશ્રી મહેશભાઈ મહેતા, આચાર્યશ્રી શિતલબેન મહેતા તથા શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલાનાં પ્રા. કે.બી.પટેલ (કેમ્પ કો-ઓર્ડીનેટર) પ્રા. પ્રતિભાબેન એમ શુક્લ (પ્રોગ્રામ ઓફિસર) તથા શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના ડાયરેક્ટર શ્રી ધીરુભાઈ વાગડીયા અને સંસ્થાના કાર્યકરો વિજયાબેન કુકવાવ અને પ્રતિભા માડ, શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાની બાવન વિદ્યાર્થીનીઓ તેમજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રતિદાદાએ આર્શીવચન પાઠવ્યા હતા. ત્યારબાદ સંસ્થાની ટીમ દ્વારા ભૂણ હત્યા અંગે સ્લાઈડ શો તેમજ ઘરેલું હિંસા અને સ્ત્રી પુરુષના ભેદભાવ પર પ્રેઝન્ટેશન મારફતે ઘરેલું હિંસા અને જેન્ડર પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સંસ્થાના સામાજિક કાર્યકર શ્રી પારુલ મહિડાએ સ્ત્રી હિંસા સંબંધી યોજાયેલ કાર્યક્રમો ઢસા (કે કે મેમોરીયલ) તથા ભુજ (સ્નેહ સમુદાય)ના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.

Engage on this month

- 2-3 Training on Quality of life.
- 4 Hand to hold book realise program by Oxfam.
- 5 Team meeting.
- 7-10 Training on social security SPIPA
- 8 Legal training by CSJ.
- 8 Review planning Meeting at CSPC
- 10 NSS camp at Chalala.
- 10 Visit to agritech week at KVK Kodinar
- 15 Off campus training at Veraval
- 16 Training for AO at CSPC
- 18 Meeting at DRDA Junagadh for SDI
- 18 Visit to MIS shop Jafrabad
- 20 Workshop on MIS at Jafrabad
- 23 Program on Girl child day at Mahila college, Amreli.
- 30 SHGs workshop at NABARD
- 30 Baseline Data collection training-CSPC

Skill development training start in this month:

Kolki (Upleta) sewing, Nagarka (Gondal) handicraft, Kantoliya (Gondal) handicraft, Supedi-Nanivavdi (Dhoraji) Aribharat, Virpur (Jetpur) handicraft, Metoda (Paddhari) sewing.

Happy birthday

- | | |
|-------------------------|----------|
| 1. Bharatbhai S. Titiya | 01-02-67 |
| 2. Mira A. Pathak | 04-02-83 |
| 3. Pramodbhai J. Joshi | 06-02-82 |
| 4. Navlika B. Patoliya | 06-02-91 |
| 5. Anjana R. Dhanesha | 08-02-91 |
| 6. Vipul B. Raval | 15-02-90 |
| 7. Payal Malviya | 15-02-90 |
| 8. Mamta S. Gosvami | 27-02-75 |

માહિતી અધિકાર હેલ્પલાઈન : ૯૯૨૪૦૮૫૦૦૦

Printed, published and edited by Hardik Dhirajlal Vagadia on behalf of Educational & Social Welfare Centre, Published from Tapak Karyalay, 26-Omnagar-3, Hanumanpara Road, Amreli and printed at Geeta Graphics, F-1 Sahjanand market, Station road, Amreli.

Post Reg. No. L2/41/G-AMR-91/RNP/2012
Valid Upto 31/12/2014

RNI No. GUJGUJ/1999/01521
Date Of Issue 1st of month

Book -Post, Printed Matter



ટપક કાર્યાલય :

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર,
૨૬,ઓમનગર(૩), હનુમાનપરા રોડ,
ગોકુલ પાર્ક સામે, અમરેલી-૩૬૫ ૬૦૧.

Tel/Fax : 02792-223525

E-mail : tapak@sskkamreli.org website: www.sskkamreli.org

મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.